https://archive.org/details/bk915/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

વાલુમાના નામે પ્રગટ થયલ "જાગો પાટીદાર" પેમ્પલેટ સબંધી અમુક મુદ્દાઓ

1. **મહિલા મંડળના કરતા હરતાઓ માટે:** નવી સમાજમાં પાંચ હાજર જેટલી મહિલાઓ સભ્ય છે. તેમાં ઘણી મહિલાઓએ કાર્યક્રમમાં સ્વામીજીને સંભાળ્યા અને ખુબ આણંદ લીધો. તેમાંથી કોઈએ પણ વાંધો લીધો નથી. તો મહિલા મંડળના કરતા હરતાઓ એ વાલુંમાંને એક પત્રમાં એવું શું જોયું કે આખી મહિલા મંડળની મીટીંગો બોલાવી નાખ્યું અને આવડી મહિલાઓને હેરાન કર્યું.
   કાલે બીજી મહિલાઓને પત્રો આવશે. વિરોધમાં એકાદ પત્ર આવ્યો પણ નવી સમાજના તરફેણમાં પણ ખુબ મોટી સંખ્યામાં પત્રો આવશે. ત્યારે તમે શું કરશો? તમારી વિચાર શૈલી પહેલાં ચોખી કરો.
2. **દીકરીઓને પ્રસંગે રડાવો:** આપણે મુંબઈમાં કઈ દીકરીના પ્રસંગમાં આ બનાવ બન્યો? આની માહિતી આપો તો તે સ્થાનિક મહિલાઓને ખબર પડે અને યોગ્ય કાર્યવાહી કરે.
3. **સતપંથી બેહેનોને ત્યાં પ્રસંગમાં શું કરવાનું તે આદેશ કોણે કાઢ્યો છે:** માતાજી તમે અખિલ ભારતીય મહિલા સંઘમાં છો, તો તમને પહેલી ખબર હોવી જોઈએ. તમારાજ પત્રના બીજા પાનામાં લખેલ છે કે આદેશ કોઈએ બહાર પાડ્યો નથી. તો પછી પહેલે પાને આવો સવાલ કરવાની જરૂર શું છે.
4. **દીકરીઓ દુઃખી હોય તો:** આપણી સમાજની દીકરી દુખી હોય તો શા માટે તમારા પાસે આવે? સ્થાનિક ગામની સમાજ કે મહિલા મંડળ પાસે શા માટે ફરિયાદ ન કરે? તમારા પાસે શા માટે આવે? તમને કોણે અધિકાર આપ્યો સમાજના નિયમો નક્કી કરવાના કે જગડા મટાડવા ના?
5. **કેન્દ્રિય સમાજના પ્રમુખ અને શ્વેત પત્ર પર:** હાલના પ્રમુખતો એક વર્ષથી છે. શ્વેત પત્ર આપણા શામજીભાઈ ઉપપ્રમુખ હતા ત્યારે તેમના નેતા ગીરી હેઠળ મુંબઈથી ભલામણ કરેલ અને પછી કચ્છથી બહાર પડ્યું છે.
6. **મુંબઈ ટ્રસ્ટ ફંડ વિષય પર:** મુંબઈ ટ્રસ્ટ ફંડના અડધા ટ્રસ્ટીઓ નવી સમાજ ભેગા છે. અને આ સમાજની નિર્માણ ૫ – ૧૫ માણસોએ નહિ પણ ૧૫ હાજર જેટલા માણસોએ કર્યું છે, એ તમારી જાણ ખાતર. આજ દિવસ સુધી કોઈ ટ્રસ્ટીએ ક્યાય ફરિયાદ કરી નથી. તો ટ્રસ્ટ નવી સમાજના વિરુદ્ધ છે એ તમે કેવી રીતે કહી શકો.
7. **માંડવી હોસ્ટેલ મદ્દે:** માંડવી હોસ્ટેલનો મુદ્દો માંડવીનો છે તેને મુંબઈથી શું લેવું દેવું? ચાલો ભૂલ થઇ એ તમોએ કબૂલ કરી. તમે લખ્યું છે કે સરકારી રાહત મળે, ગ્રાન્ટ મળે એટલે નવું ટ્રસ્ટ બનાવ્યું. પણ કેન્દ્રિય સમાજ પાસે શિક્ષણ હેતુ થી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા છે, જેમાં હોસ્ટેલ, કોલેજો ચાલે છે અને સરકારી રાહત મળે છે. તો પછી કેન્દ્રિય સમાજ પાસે આ વાત લઈને જવું હતું ને? ચોર ચોરી કરતે પકડાઈ ગયો એટલે કેરો કે મેં ગરીબોમાં બાટવા માટે ચોરી કરેલ છે. શું આપણે સમાજના લોકોને આવો સંદેશો આપવા માંગીએ છીએ કે ચોરી કરો અને પકડાઈ જાઓ તો સમાજ માટે કરી છે તેવું કહીને છૂટી જાઓ. કાલે ડોંબીવલી વાડી વાળા ભાઈઓ પણ આવું ગતકડું કરશે અને કહેશે કે ડોંબીવલીના ભાઈઓ ના હિત માટે કર્યું છે ડોંબીવલી પર અન્યાય થતો હતો એટલે કર્યું છે, તો શું આપણે એ ચલાવી લેશું? અને કેન્દ્રિય સમાજ તો કહે છે કે જેમ હતું તેમ પછી નિર્માણ સમિતિના નામે હોસ્ટેલને કરી નાખો. તો તેમાં ખોટી શું છે?
8. **માતાજીનું પોતાનું ગામ દરશડીએ શું કર્યું:** સતપંથનું મંદિર ન બને એટલે દરશડી સમાજે કોર્ટથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે. શા માટે? તેનો વિરુદ્ધમાં તમે કંઈ કામ કેમ નથી કરતા? ત્યાં ગામમાની સમાજ સામે પત્ર લખ્યો? ત્યાં મીટીંગ બોલાવી? ત્યાં શું એકતા નોહતી તૂટતી?
9. **દરશડી ગામ:** દરશડી ગામના સતપંથી લોકોને શા માટે ગામ જમણવારમાં બહાર રાખો છો? ત્યારે તમારી સતપંથી બહેન દીકરીઓનું મન નથી દુભાતું? સમાજ સુધારની અને એકતાની શરૂઆત પહેલાં ઘરથી કેમ નથી કરતા?
10. **મુંબઈમાં વેસ્ટર્ન ઝોન:** વેસ્ટર્ન ઝોન બન્યું તેમાં તમારો શું રોલ છે? ટ્રસ્ટે કોઈ દિવસ વેસ્ટર્ન ઝોનને માન્યતા આપેલ નથી. તો શું આ ઝોન બનાવીને મુંબઈના ભાગલા નથી થયા? અને તેની એકતા તૂટી નથી? જો તૂટી નથી તો અમને એટલે બાકીનોને સમાજના પ્રવાહમાં મેમ્બર બનવું હોય તો શું કરવું પડશે? જે લોકોને જણાવો.

realpatidar.com

https://archive.org/details/bk915/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk915/page/n2/mode/1up

realpatidar.com

વાલુમાના નામે પ્રગટ થયલ "જાગો પાટીદાર" પેમ્પલેટ સબંધી અમુક મુદ્દાઓ

1. **મહિલા મંડળના કરતા હરતાઓ માટે:** નવી સમાજમાં પાંચ હાજર જેટલી મહિલાઓ સભ્ય છે. તેમાં ઘણી મહિલાઓએ કાર્યક્રમમાં સ્વામીજીને સંભાળ્યા અને ખુબ આણંદ લીધો. તેમાંથી કોઈએ પણ વાંધો લીધો નથી. તો મહિલા મંડળના કરતા હરતાઓ એ વાલુંમાંને એક પત્રમાં એવું શું જોયું કે આખી મહિલા મંડળની મીટીંગો બોલાવી નાખ્યું અને આવડી મહિલાઓને હેરાન કર્યું.

   કાલે બીજી મહિલાઓને પત્રો આવશે. વિરોધમાં એકાદ પત્ર આવ્યો પણ નવી સમાજના તરફેણમાં પણ ખુબ મોટી સંખ્યામાં પત્રો આવશે. ત્યારે તમે શું કરશો? તમારી વિચાર શૈલી પહેલાં ચોખી કરો.

2. **દીકરીઓને પ્રસંગે રડાવો:** આપણે મુંબઈમાં કઈ દીકરીના પ્રસંગમાં આ બનાવ બન્યો? આની માહિતી આપો તો તે સ્થાનિક મહિલાઓને ખબર પડે અને યોગ્ય કાર્યવાહી કરે.

3. **સતપંથી બેહેનોને ત્યાં પ્રસંગમાં શું કરવાનું તે આદેશ કોણે કાઢ્યો છે:** માતાજી તમે અખિલ ભારતીય મહિલા સંઘમાં છો, તો તમને પહેલી ખબર હોવી જોઈએ. તમારાજ પત્રના બીજા પાનામાં લખેલ છે કે આદેશ કોઈએ બહાર પાડ્યો નથી. તો પછી પહેલે પાને આવો સવાલ કરવાની જરૂર શું છે.

4. **દીકરીઓ દુ:ખી હોય તો:** આપણી સમાજની દીકરી દુખી હોય તો શા માટે તમારા પાસે આવે? સ્થાનિક ગામની સમાજ કે મહિલા મંડળ પાસે શા માટે ફરિયાદ ન કરે? તમારા પાસે શા માટે આવે? તમને કોણે અધિકાર આપ્યો સમાજના નિયમો નક્કી કરવાના કે જગડા મટાડવા ના?

5. **કેન્દ્રિય સમાજના પ્રમુખ અને શ્વેત પત્ર પર:** હાલના પ્રમુખતો એક વર્ષથી છે. શ્વેત પત્ર આપણા શામજીભાઈ ઉપપ્રમુખ હતા ત્યારે તેમના નેતા ગીરી હેઠળ મુંબઈથી ભલામણ કરેલ અને પછી કચ્છથી બહાર પડ્યું છે.

6. **મુંબઈ ટ્રસ્ટ ફંડ વિષય પર:** મુંબઈ ટ્રસ્ટ ફંડના અડધા ટ્રસ્ટીઓ નવી સમાજ ભેગા છે. અને આ સમાજની નિર્માણ ૫ – ૧૫ માણસોએ નહિ પણ ૧૫ હાજર જેટલા માણસોએ કર્યું છે, એ તમારી જાણ ખાતર. આજ દિવસ સુધી કોઈ ટ્રસ્ટીએ ક્યાય ફરિયાદ કરી નથી. તો ટ્રસ્ટ નવી સમાજના વિરુદ્ધ છે એ તમે કેવી રીતે કહી શકો.

7. **માંડવી હોસ્ટેલ મદ્દે:** માંડવી હોસ્ટેલનો મુદ્દો માંડવીનો છે તેને મુંબઈથી શું લેવું દેવું? ચાલો ભૂલ થઇ એ તમોએ કબૂલ કરી. તમે લખ્યું છે કે સરકારી રાહત મળે, ગ્રાન્ટ મળે એટલે નવું ટ્રસ્ટ બનાવ્યું. પણ કેન્દ્રિય સમાજ પાસે શિક્ષણ હેતુ થી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા છે, જેમાં હોસ્ટેલ, કોલેજો ચાલે છે અને સરકારી રાહત મળે છે. તો પછી કેન્દ્રિય સમાજ પાસે આ વાત લઈને જવું હતું ને? ચોર ચોરી કરતે પકડાઈ ગયો એટલે કેરો કે મેં ગરીબોમાં બાટવા માટે ચોરી કરેલ છે. શું આપણે સમાજના લોકોને આવો સંદેશો આપવા માંગીએ છીએ કે ચોરી કરો અને પકડાઈ જાઓ તો સમાજ માટે કરી છે તેવું કહીને છૂટી જાઓ. કાલે ડોંબીવલી વાડી વાળા ભાઈઓ પણ આવું ગતકડું કરશે અને કહેશે કે ડોંબીવલીના ભાઈઓ ના હિત માટે કર્યું છે ડોંબીવલી પર અન્યાય થતો હતો એટલે કર્યું છે, તો શું આપણે એ ચલાવી લેશું? અને કેન્દ્રિય સમાજ તો કહે છે કે જેમ હતું તેમ પછી નિર્માણ સમિતિના નામે હોસ્ટેલને કરી નાખો. તો તેમાં ખોટી શું છે?

8. **માતાજીનું પોતાનું ગામ દરશડીએ શું કર્યું:** સતપંથનું મંદિર ન બને એટલે દરશડી સમાજે કોર્ટથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે. શા માટે? તેનો વિરુદ્ધમાં તમે કંઈ કામ કેમ નથી કરતા? ત્યાં ગામમાની સમાજ સામે પત્ર લખ્યો? ત્યાં મીટીંગ બોલાવી? ત્યાં શું એકતા નોહતી તૂટતી?

9. **દરશડી ગામ:** દરશડી ગામના સતપંથી લોકોને શા માટે ગામ જમણવારમાં બહાર રાખો છો? ત્યારે તમારી સતપંથી બહેન દીકરીઓનું મન નથી દુભાતું? સમાજ સુધારની અને એકતાની શરૂઆત પહેલાં ઘરથી કેમ નથી કરતા?

10. **મુંબઈમાં વેસ્ટર્ન ઝોન:** વેસ્ટર્ન ઝોન બન્યું તેમાં તમારો શું રોલ છે? ટ્રસ્ટે કોઈ દિવસ વેસ્ટર્ન ઝોનને માન્યતા આપેલ નથી. તો શું આ ઝોન બનાવીને મુંબઈના ભાગલા નથી થયા? અને તેની એકતા તૂટી નથી? જો તૂટી નથી તો અમને એટલે બાકીનોને સમાજના પ્રવાહમાં મેમ્બર બનવું હોય તો શું કરવું પડશે? જે લોકોને જણાવો.

realpatidar.com

realpatidar.com

11. **<u>નવી સમાજ બનાવીને સમાજ તોડેરા:</u>** જો નવી સમાજ બનવાથી સમાજ તૂટે છે તો તે સમાજના મેમ્બર ન બનવું જોઈએ. જો પાંચ પંદર માણસોજ સમાજ ઉભી કરે છે તો પછી ઓટોમેટિક સમાજ નહિ બને. આમાં મોટી વાત ક્યાં છે? આપણે કોઈને પણ સમાજ બનાવાથી અટકાવી ન શકીએ.

12. **<u>તમરા નામે મોકલેલ પેમ્પલેટ કોને લખ્યું છે:</u>** આ પેમ્પલેટમાં તમે...

   a. સતપંથમાં વળાવેલ દીકરીઓ પર થતી - કહેવાતી - અન્યાયની વાત કરી છે. પણ અન્યાય થતો હોય તો તેના સગા ભાઈઓ અને માં-બાપ કરતા હશે. આપડી સમાજ ક્યાં કરે રી.

   b. ઉપરથી બહાર પાડેલ આદેશની વાત લખીને મહિલોને ઉશ્કેરો છો. અને પાછળથી એ વાત પર કબૂલ કરો છો કે આવો આદેશ સમાજે બહાર પાડેલ નથી.

   c. ત્યાર બાદ મુંબઈમાં નવી સમાજ ૫ – ૧૫ માણસો મળીને ઉભી કરેલ છે એવું લખ્યું છે, જે તમે જાણો છો કે ખોટી વાત છે. મુંબઈ ટ્રસ્ટ ફંડના અડધા ટ્રસ્ટીઓ નવી સમાજ સાથે છે. તો ટ્રસ્ટની વિરુદ્ધ કામ થાય છે એ પણ ખોટી સિદ્ધ થાય છે.

   d. માંડવી હોસ્ટેલમાં નિર્માણ સમિતિએ ક્યાંક ભૂલ કરી છે એ વાતને તમે પોતે સ્વીકારી. તો પછી પેમ્પલેટમાં આ વાત લખવાનો ઉદ્દેશ શું હોઈ શકે?

   e. મહિલાઓની ફરજમાં આવે છે કે ખરા અર્થમાં ધર્મને ટકાવી રાખવો. એટલ પેમ્પલેટમાં એક મહિલા તરીકે તમે ધર્મને છોડી દેવાની વાત કરો એ વાત સારી નથી. ઘર અને સમાજનું ઉત્થાન કરવું હશે તો ધર્મને સાથે રાખવું પડશે તેમાં કોઈ બે મત નથી.

   f. સતપંથ ભાઈ ખોટ કેસ કરે છે તે મજબુરીમાં કરે છે એવું તમને કેવી રીતે ખબર પડી? ખોટા કોર્ટ કેસો એ ખોટા હોય છે. આખી જ્ઞાતિ સતપંથી ખોટા કેસો કરે છે તેવું કહે છે. તો તમે કેમ સતપંથ તરફી વાત કરો છો?

   ઉપર જણાવેલ અમુક મુદ્દાઓ પર થી સમજણ પડે છે કે આ પત્ર લખવા માં કેટલી બધી ભૂલો અને વિરોધાભાષી વાતો છે. તમે આવડી ભૂલ કરો એવું અમે માની શકીએ નહિ. તો માતાજી, ઉમિયામાના સમ લઈને કહો, કે ખરે ખર આ પત્ર કોણે લખ્યો છે?

13. **<u>એકતા મંચ:</u>** મુંબઈના ટ્રસ્ટીઓની મદદ માટે રચાયેલ “એકતા મંચ”એ કોણે અને કેટલી સમાજોને વિશ્વાસમાં લઇને બનાવ્યો છે? અને કેટલા મુંબઈના ટ્રસ્ટીઓને પૂછીને બનાવ્યો? તેનો ખુલ્લાસો કરશો.
એકતા મંચ ખુલ્લે આમ કહે છે કે મુંબઈમાં શ્વેત પત્રનો અમલ કરવા નહિ દઈએ અને સતપંથીઓ સાથે સબંધ નહિ કાપીએ. હાલના પાટીદાર સંદેશ (એપ્રિલ ૨૦૧૩) માં તંત્રી એ લખ્યું છે કે અમુક લોકો કે જેમની સંખ્યા ખુબજ ઓછી છે, સમાજમાં “સનાતની અને સતપંથી એકતા”ના બેનર હેઠળ, સતપંથી ભાઈઓ સાથે બેસીને જાણે અજાણે સનાતની એકતાને નબળી કરવાનું કાર્ય કરતા હોય છે. આ લોકો પોતાની શક્તિ વેડફવાને બદલે સમાજના મૂળ પ્રવાહમાં ભળી જઈને સનાતની એકતા મજબુત કરવાની વાત લખી છે. તો તેના માટે એકતા મંચ વિરુદ્ધ તમે કામ કરો ને?

14. **<u>બીજા સંપ્રદાયોની સમાજો છે:</u>** મુંબઈમાં કેટલાય વર્ષોથી “આર્ય સમાજ”, સત્યનારાયણ, સ્વામીનારાયણ, સતપંથ સમાજ, સ્વાધ્યાય પરિવાર અસ્તિત્વમાં છે અને સમાજ ઉપયોગી કાર્યો કરે છે. આવીજ રીતે લક્ષ્મીનારાયણ સનાતન સમાજ પણ સારા ઉદ્દેશો ને સાથે લઈને બનાવી છે. તેમાં તકલીફ શું છે.

15. **<u>સદ બુદ્ધિ દે</u>**: લક્ષ્મીનારાયણ ભગવાનની રથ યાત્રાનો મુંબઈમાં - થાણા, ઘાટકોપર, ડોંબીવલી, ખારઘર, કામોઠે, શહાડ, પનવેલ વગેરે સમાજોએ લાભ લીધો. તો વેસ્ટર્ન સાઈડની સમાજોએ શા માટે લાભ ન લીધો? તેનું કારણ શું?
તમે તમારા પત્રમાં ભગવાન લક્ષ્મીનારાયણ સદ બુદ્ધિ દે એવું લખ્યું છે, તો પછી વેસ્ટર્ન સાઈડના લોકોને લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદ નથી જોઈતા?

realpatidar.com